

પ્રશ્ન-૩:

તૃપ્તિ અને દિપ્તિ ૩ : ૨ ના પ્રમાણમાં નફો-નુકસાન વહેંચવાની શરતે સંયુક્ત સાહસમાં જોડાય છે. સંયુક્ત સાહસનો વહીવટ સંપૂર્ણપણે તૃપ્તિને સોંપવામાં આવે છે. તે પેટે તેને મહેનતાણા તરીકે વેચાણ પર ૧૦% કમિશન આપવાનું છે. દિપ્તિ રાશિ પેટે રૂ. ૪૦,૦૦૦ તૃપ્તિને આપે છે. તૃપ્તિ ૨,૦૦૦ લિટર ઓઈલ રૂ. ૧૦ લેખે સંયુક્ત સાહસ માટે પોતાના સ્ટોકમાંથી આપે છે અને રાશના ધંધા અંગે ૪,૦૦૦ લિટર ઓઈલ રૂ. ૧૦ લેખે ખરીદે છે. નૂરના રૂ. ૧,૨૦૦ ચૂકવ્યા.

તૃપ્તિએ દિપ્તિ પર રૂ. ૧૦,૦૦૦ ની હૂંડી લખી. દિપ્તિએ સ્વીકારી. તૃપ્તિએ તે હૂંડી રૂ. ૮,૭૦૦ માં વટાવી. તૃપ્તિએ ૫,૦૦૦ લિટર ઓઈલ લિટરદીઠ રૂ. ૧૫ લેખે વેચાણ કર્યું. વેચાણ ખર્ચના રૂ. ૧,૦૦૦ ચૂકવ્યા. બાકીનું તૃપ્તિએ લિટરદીઠ રૂ. ૧૨ લેખે ખરીદી લીધું. વ્યવહારો પૂરા થતાં તૃપ્તિએ દિપ્તિને બાકીના નાણાં ચકિવી હિસાબ ચૂકવે કરે છે અને સંયુક્ત સાહસ બંધ કરે છે. તૃપ્તિના ચોપડે આમનોંધ અને જરૂરી ખાતાંઓ તૈયાર કરો.

પ્રશ્ન-૪: શ્રી જયેશ પટેલ પોતાના હિસાબો ઓકનોંધી પદ્ધતિ પ્રમાણે રાખે છે. નીચેની વિગતો પરથી તા. ૩૧મી માર્ચ, ૨૦૧૮ના રોજ પૂરા થતાં વર્ષનું વેપાર ખાતું, નફા-નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરો. (૧૫)

હાથ પર રોકડ (૧-૪-૨૦૧૭)	૪,૮૦૦	રોકડ ખરીદી	૭,૫૦૦
દેવાદારો પાસેથી મળ્યા	૧,૧૦,૦૦૦	પગાર	૧૩,૫૦૦
રોકડ વેચાણ	૮,૦૦૦	મજૂરી	૬,૨૫૦
પરચૂરણ આવક	૧,૩૫૦	સામાન્ય ખર્ચ	૩,૮૦૦
લેણદારોને ચૂકવ્યા	૬૮,૦૦૦	ઉપાડ	૫,૦૦૦

મિલકત અને દેવાંની વિગતો:

	૧-૪-૨૦૧૭	૩૧-૩-૨૦૧૮
મકાન	૧૮,૦૦૦	૨૫,૦૦૦
ફર્નિચર	૪,૫૦૦	૩,૦૦૦
ચંબ્રો	૨૫,૦૦૦	૨૫,૦૦૦
દેવાદારો	૩૨,૦૦૦	૨૮,૦૦૦
લેણદારો	૧૩,૦૦૦	૨૧,૦૦૦
સ્ટોક	૨૦,૫૦૦	૨૬,૫૦૦

વર્ષ દરમિયાન રૂ. ૧,૬૦૦નો વટાવ આપવામાં આવ્યો છે. જ્યારે રૂ. ૮૦૦નો વટાવ મળ્યો છે. રૂ. ૪૦૦નો વેચેલ માલ પરત આવ્યો હતો. તેણે રૂ. ૧,૦૦૦નો ખરીદેલો માલ પાછો મોકલી આપ્યો હતો. મકાન અને ફર્નિચર પર અનુક્રમે રૂ. ૧,૫૦૦ અને રૂ. ૩૦૦ ધરાસારો ગણો. દેવાદારો પર ૫% ધાવખાધ અનામત રાખો. મૂડી પર ૫% વ્યાજ ગણવાનું છે.

અથવા

પ્રશ્ન-૪

(અ) ઓકનોંધી પદ્ધતિના લક્ષણો જણાવો.

(૦૫)

(૩)

(PT)